

गुजरात विद्यापीठ : अमदावाड

परीक्षार्थी क्रमांक

शिक्षण विद्याशाखा (IASE), अमदावाड

बेयलर ऑफ़ ऐज्युकेशन (बी.एड. / हिन्दी बी.एड.) सत्र - 4

वसंतपंचमी सत्र, सत्रांत परीक्षा: मे 2025

BED405.3 : योगनुं शिक्षण

HBED405.3 : योग की शिक्षा

तल. 6-05-2025

समय : 8-00 थी 10-30

वार : मंगलवार

कुल गुण : 60

अध्ययन नीपज

योगनी संकल्पना अने छतिहास विशे समजावे.

योग की अवधारणा और इतिहास की व्याख्या करें।

भारतीय ज्ञान प्रणालीमां योगनुं स्वरूप तेमज मानव स्वास्थ्यमां योगनुं महत्व जणावे.

भारतीय ज्ञान प्रणाली में योग की प्रकृति और मानव स्वास्थ्य में योग के महत्व को स्पष्ट करें।

अष्टांग योगनुं परिचय अने मानवीय मूल्योना विकासमां यम अने नियमनी भूमिका विशे समज आपे.

अष्टांग योग का परिचय और मानवीय मूल्यों के विकास में यम और नियम की भूमिका को व्यक्त करें।

बहिरंग योग अने अंतरंगयोगनी संकल्पना समजावे.

बहिरंग योग और अन्तरंग योग की अवधारणाओं की व्याख्या करें।

हठयोग अने राजयोगनुं परिचय अने तझावत स्पष्ट करे.

हठयोग और राजयोग के मध्य अंतर का परिचय और व्याख्या करें।

योगासनो डरमियान राभवानी सावयेतीनी समज आपे तेमज विविध आसनोनुं निदर्शन करे.

योगासन के दौरान ध्यान रखनेवाली सावधानियों के बारे में बताएं और साथ ही विभिन्न आसनों का प्रदर्शन करें।

प्राणायामनी संकल्पना, महत्व तेमज विविध प्रणायामोनुं निदर्शन करी बतावे.

प्राणायाम की अवधारणा, महत्व और विभिन्न प्राणायामों का प्रदर्शन करें।

प्रश्न-1. नीचेनामांथी कोष्ठ पण पांच प्रश्नोना जवाब लपो.

निम्नलिखित में से किसी भी पांच प्रश्नों के उत्तर लिखिए.

(20)

1. योगनी संकल्पना स्पष्ट करे.

योग की संकल्पना स्पष्ट कीजिए।

2. शारीरिक स्वास्थ्यमां योगनुं महत्व जणावो.

शारीरिक स्वास्थ्य में योग का महत्व बताईये।

3. बहिरंग योगनी संकल्पना स्पष्ट करी बहिरंग योगमां सामेल विविध अंगो विशे लपो.

बहिरंग योग की संकल्पना स्पष्ट करते हुये इसमें शामिल विभिन्न अंगों के बारे में लिखिए।

4. सांवेगिक स्वास्थ्यमां योगनी भूमिका थी छे? तेनी स्पष्टता करे.

भावनात्मक स्वास्थ्य में योग की भूमिका क्या है? स्पष्ट कीजिए।

5. "त्रिकोणासन" करवानी विधि अने महत्वनी चर्चा करे.

"त्रिकोणासन" करने की विधि और उसके महत्व की चर्चा कीजिए।

6. मानवीय मूल्योनी स्थापनामां "यम"नी भूमिकानुं वर्णन करे.

मानवीय मूल्यों की स्थापना में "यम" की भूमिका का वर्णन कीजिए।

7. पाचन तंत्र संबंधित आरोग्य जणवी राभवामां सहायक येवा बे आसनोनी चर्चा करे.

पाचन तंत्र से संबंधित स्वास्थ्य को बनाए रखने में सहायक दो आसनों की चर्चा कीजिए।

પ્રશ્ન 2. નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખો.

(20)

નિમ્નલિખિત મેં સે કિસીં ભીં ઢો પ્રશ્નોં કે ઉત્તર લિખિં.

1. પ્રાણાયામની સંકલ્પના સ્પષ્ટ કરી, પરિચય, કરવાની વિધિ અને મહત્ત્વને ધ્યાનમાં રાખી પ્રાણાયામના કોઈ બે પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો.
પ્રાણાયામ કી સંકલ્પના સ્પષ્ટ કરતે હુ, પરિચય, કરને કી વિધિ ઓર મહત્ત્વ કો ધ્યાન મેં રલ્કર પ્રાણાયામ કે કિન્હી ઢો પ્રકારોં કી વિસ્તૃત ચર્ચા કીજિં.
2. યોગાસન કરતી વખતે ધ્યાન રખવા યોગ્ય બાબતો વિશે સવિસ્તાર લખો.
યોગાસન કરતે સમય ધ્યાન રલ્કને યોગ્ય બારોં કે બારે મેં વિસ્તાર સે લિખિં.
3. "નિયમ" ની સંકલ્પના સ્પષ્ટ કરી વિદ્યાર્થી જીવનમાં તેની ભૂમિકા સ્પષ્ટ કરો.
"નિયમ" કી સંકલ્પના સ્પષ્ટ કરતે હુ વિદ્યાર્થી જીવન મેં ઇસકી ભૂમિકા સ્પષ્ટ કીજિં.

પ્રશ્ન 3. નીચેનામાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ લખો.

નિમ્નલિખિત મેં સે કિસીં ભીં તોન પ્રશ્નોં કે ઉત્તર લિખિં.

(15)

1. હઠયોગ અને રાજયોગ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરો.
હઠયોગ ઓર રાજયોગ કે બીચ કે અંતર કો સ્પષ્ટ કીજિં.
2. અષ્ટાંગ યોગ પ્રમાણે સમાધિની વિભાવના અને તેના પ્રકાર વિશે લખો.
અષ્ટાંગ યોગ કે અનુસાર સમાધિ કી અવધારણા ઓર ઇસકે પ્રકારોં કે બારે મેં લિખિં.
3. "મનને સ્વસ્થ રાખવામાં યોગ ખુબજ ઉચ્ચોગી છે". આ વિધાન વિશે આપના વિચાર રજૂ કરો.
મન કો સ્વસ્થ રલ્કને મેં યોગ બહુત ઉપયોગી હૈ - ઇસ કથન પર અપને વિચાર પ્રસ્તુત કીજિં.
4. અંતરંગ યોગના વિવિધ તબક્કાઓ વિશે સમજૂતી આપો.
અંતરંગ યોગ કે વિભિન્ન ચરણોં કી વ્યાખ્યા કીજિં.
5. વજ્રાસનનો પરિચય આપી તેનું મહત્ત્વ જણાવો.
વજ્રાસન કા પરિચય ઢેતે હુ ઇસકા મહત્ત્વ બતાઈયે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ લખો.

નીચે ઢિં ઢુ પ્રશ્નોં કે ઇક-ઢો વાક્યોં મેં ઉત્તર લિખિં.

(05)

1. હઠયોગ પ્રદીપિકાના રચનાકાર કોણ છે?
હઠયોગ પ્રદીપિકા કે રચયિતા કોન હૈં?
2. યોગસૂત્રમાં રહેલા પાદો(અધ્યાયો)નું નમોલ્લેખ કરો.
યોગસૂત્ર મેં વર્ણિત પાદ (અધ્યાયો) કે નામ લિખિં.
3. હઠયોગમાં ઉલ્લિખિત ષટકર્મોનું નમોલ્લેખ કરો.
હઠયોગ મેં ઉલ્લિખિત ષટકર્મોં કે નામ લિખિં.
4. પ્રત્યાહાર એટલે શું?
પ્રત્યાહાર ક્યા હોતા હૈં?
5. સૂઈને કરવાના કોઈ બે આસનોનું નામ જણાવો.
સોકર કિં ઢાને વાલે કિસીં ભીં ઢો આસનોં કે નામ બતાઈયે.

-----*-----